

**Sun Pharmaceutical Industries Ltd.**

Sun House, Plot No. 201 B/1,  
Western Express Highway, Goregaon (E),  
Mumbai - 400 063, Maharashtra, INDIA.  
Tel. : (91-22) 4324 4324  
Fax : (91-22) 4324 4343  
www.sunpharma.com  
CIN : L24230GJ1993PLC019050



**May 18, 2017**

**National Stock Exchange of India Limited,**  
Exchange Plaza, 5th Floor,  
Plot No. C/1, G Block,  
Bandra Kurla Complex,  
Bandra (East), Mumbai – 400 051.  
**NSE Code: SUNPHARMA**

**BSE Limited,**  
Market Operations Dept.  
P. J. Towers, Dalal Street,  
Mumbai - 400 001  
**BSE Code:524715**

Dear Sir/Madam,

**Sub: Newspaper Advertisement regarding Notice of postal ballot and remote e-voting for NCLT Convened Meeting of equity shareholders of Sun Pharmaceutical Industries Limited (“the Company”)**

In terms of the provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of the newspaper advertisement published in Financial Express (English and Gujarati Language) in all editions and Vadodara Samachar (Gujarati Language) in Vadodara Edition, regarding Notice of the postal ballot and remote e-voting for NCLT Convened Meeting of equity shareholders of the Company to be held on Tuesday, June 20, 2017 at 10:15 a.m. IST, for the purpose of considering, and if though fit, approving with or without modification(s), the Scheme of Arrangement among Sun Pharma Medisales Private Limited, Ranbaxy Drugs Limited, Gufic Pharma Limited, Vidyut Investments Limited (being the wholly owned subsidiaries of the Company) and the Company and their respective members and creditors.

This is for your information and record.

Thanking You

Yours faithfully

For **Sun Pharmaceutical Industries Limited**

**Ashok I Bhuta**  
**Sr. GM – Secretarial &**  
**Compliance Officer**



Enclosure: as above



**FINANCIAL EXPRESS**

**ASHIANA HOUSING LIMITED**  
 CIN: L70109WB1986PLC040864  
 Regd. Office: 5F, Everest, 46/C, Chowringhee Road, Kolkata - 700 071  
 Head Office: Unit No. 4&5, 3rd Floor, Saket District Center, Saket, New Delhi-110 017  
 Phone: 011-42654265, Fax: 011-42654200  
 Email: investorrelations@ashianahousing.com website: www.ashianahousing.com

**NOTICE**  
 This is to inform that next meeting of the Board of Directors of the company will be held on Tuesday, 30th May, 2017 at 10.30 AM at the Head office of the company at Unit No. 4 & 5, 3rd Floor, Saket District Center, Saket, New Delhi - 110 017, to consider and approve annual audited financial results of the company for the financial year ended on 31st March, 2017 including audited quarterly financials in respect of the last quarter ended on 31st March, 2017, apart from other routine items.

By Order of the Board  
**Ashiana Housing Ltd.**  
 Sd/-  
**Nitin Sharma**  
 (Company Secretary)  
 ACS: 21191  
 Place: New Delhi  
 Date: 17/05/2017

**STAR PAPER MILLS LIMITED**  
 Registered Office: Duncan House, 2nd Floor, 31, Netaji Subhas Road, Kolkata 700 001  
 Ph: 033-22427380 Fax: 033-22427383  
 CIN: L21011WB1936PLC008726  
 E-mail: star.cal@starpapers.com Web: www.starpapers.com

**Notice**  
 Notice is hereby given pursuant to the provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the company is scheduled to be held on Thursday, 25th May, 2017 at New Delhi to inter-alia consider and approve the Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2017 and consider recommendation of dividend for FY 2016-17.

The Notice is also available on website of the company (www.starpapers.com) and that of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com).  
 Further, as per Insider trading code of the company, 'Trading Window' shall remain closed from 18th May, 2017 to 27th May, 2017 (both days inclusive).

for STAR PAPER MILLS LTD.  
 Sd/-  
**SAURABH ARORA**  
 (Company Secretary)  
 Saharanpur (U.P)  
 16th May, 2017.

**TAMIL NADU NEWSPRINT AND PAPERS LIMITED**  
 Kagithapuram - 639 136, Karur Dist. Tamil Nadu,  
 Phone : 04324 - 277 001 (10 Lines) Fax : 04324 - 277 025 / 276 368  
 e-mail : purchase.rawmat@tnpl.co.in , purchase.packing@tnpl.co.in

**NOTICE INVITING TENDER**

Tender No.	Material Description	Quantity	EMD (Rs.)	Tender due date	Method of tender
171813 000693	LIQUID P.A.C. (POLY ALUMINIUM CHLORIDE)	15,30,000 KGS	1,00,000/-	31/05/2017	TENDER CUM AUCTION METHOD
171813 000242	120 GSM SHEETS 114 X 140 CM	130 MT	50,000/-	05/06/2017	
171813 000694	ENLISTMENT OF VENDORS FOR SUPPLY OF ; > SULPHURIC ACID > SULPHUR DI-OXIDE AND > ORTHO PHOSPHORIC ACID	---	---	01/06/2017	---

Interested suppliers/vendors may apply for tender documents and the same can be obtained from DGM (PURCHASE) at the above said address on payment of non-refundable tender fee of Rs.500/- for each tender separately by RTGS/NEFT directly to TAMIL NADU NEWSPRINT AND PAPERS LIMITED. Alternatively, the tender documents can be downloaded from websites: www.tnpl.com and www.tenders.tn.gov.in and tender fee of Rs.500/- for each tender separately can be submitted by RTGS/NEFT directly to TAMIL NADU NEWSPRINT AND PAPERS LIMITED, along with Technical-cum-Commercial Bid/Enlistment Application.

DIPR/2113/Tender/2017 **TNPL - Maker of bagasse based eco-friendly Paper**

**SUN PHARMACEUTICAL INDUSTRIES LIMITED**  
 Registered Office: SPARC, Tandajja, Vadodra - 390 020, Gujarat, India.  
 Tel No.: 0265-6615500/ 600/ 700; Fax No.: 0265-2354897  
 Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063, Maharashtra, India.  
 CIN: L24230GJ1993PLC019050  
 Email id: secretarial@sunpharma.com; Website: www.sunpharma.com

**NOTICE OF POSTAL BALLOT AND REMOTE E-VOTING FOR MEETING OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY**

NOTICE is hereby given that by an order dated April 18, 2017, the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ("NCLT"), has directed that a meeting of the equity shareholders of Sun Pharmaceutical Industries Limited ("Company"), shall be held on Tuesday, June 20, 2017 at 10:15 a.m. IST, at Sir Sayajirao Nagargruh, Akota, Vadodra - 390 020, Gujarat, India, for the purpose of considering, and if thought fit, approving, with or without modification(s), the scheme of arrangement among Sun Pharma Mediasales Private Limited, Ranbaxy Drugs Limited, Gufic Pharma Limited, Vidyut Investments Limited and Sun Pharmaceutical Industries Limited and their respective members and creditors ("Scheme of Arrangement").

The equity shareholders of the Company are hereby informed and requested to note that:

1) Pursuant to the directions issued by NCLT by an order dated April 18, 2017 and the provisions of Section 230(4) read with Section 108 and 110 of the Companies Act, 2013 read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has provided the facility to the equity shareholders to cast their votes either by way of postal ballot or through remote e-voting facility or by way of poll at the venue of the Meeting.

The Company is providing facility for voting by electronic means through E-voting platform of Central Depository Services (India) Limited (CDSL). The necessary instructions for remote e-voting have been set out in the said Notice of the NCLT Convened Meeting of the equity shareholders dated April 26, 2017.

2) The cut-off date for determining the eligibility for the equity shareholders to vote is March 31, 2017.

3) The Company has sent by an email, the Notice of NCLT Convened Meeting of the equity shareholders of the Company to all the members whose email addresses were available with the Company/Depositories and completed dispatch of the Notice of NCLT Convened Meeting of the equity shareholders along with Proxy Form, Attendance Slip, Postal Ballot Form and Business Reply Envelope to the Members at their registered address as on May 13, 2017, to those Members who have not registered their email addresses and those members who have opted for a physical copy of the same.

4) The Voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the names of equity shareholders as on March 31, 2017. Persons who are not equity shareholders of the Company as on the cut-off date i.e. March 31, 2017 should treat this notice for information purposes only.

5) The Voting period for postal ballot and remote e-voting shall commence on and from Sunday, May 21, 2017 at 9:00 a.m. IST and end on Monday, June 19, 2017 at 5:00 p.m. IST (inclusive of both the days). During the voting period, Members of the Company holding equity shares either in physical form or in a dematerialised form as on cut-off date may cast their vote either through Postal Ballot Form or remote e-voting.

6) The Members of the Company are requested to vote by remote e-voting or communicate their assent or dissent by returning duly filled in and signed Postal Ballot Form on or before 5:00 p.m. IST on Monday, June 19, 2017 to the scrutinizier M/s. C. J. Goswami and Associates, at the address: C/o. Sun Pharmaceutical Industries Limited, Corporate Office, Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon East, Mumbai, Maharashtra (India) - 400 063. Any Postal Ballot Form received from the Member thereafter will not be valid and will be treated as if reply from the Member has not been received and remote e-voting module shall be disabled by CDSL for voting thereafter.

7) The Company is also providing facility for voting by way of polling papers at the meeting for the Members attending the meeting, who have not cast their vote by postal ballot or remote e-voting.

8) During the voting period, the equity shareholders can opt for only one mode for voting, i.e. either the postal ballot or remote e-voting. In case of any equity shareholder cast the vote via both these modes, voting validly done through remote e-voting shall prevail. Equity Shareholders who have cast the vote through Postal Ballot or remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again; such votes, if cast at the meeting shall be treated invalid.

9) Any Member who has not received the Postal Ballot Form and is desirous of obtaining a duplicate along with Business Reply Envelope thereof, may request by letter at the corporate office of the Company or at Link Intime India Private Ltd., the Registrar and Share Transfer Agent, at C 101, 247 Park, L B S Marg, Vikhroli West, Mumbai 400 083 or by sending an e-mail from their registered email id to secretarial@sunpharma.com or sunpharma@linkintime.com.in.

10) NCLT Convened Meeting notice dated April 26, 2017, is available on Company's website www.sunpharma.com and CDSL website www.evotingindia.com.

11) The Scrutinizer shall submit a consolidated Scrutinizer's Report of the total votes cast in favour of or against, if any, after the conclusion of the meeting to the Chairman of the Meeting or a person authorised by him. The results would be displayed at the Registered Office and Corporate Office of the Company, intimated to the stock exchanges where the Company's securities are listed and displayed along with the scrutinizier's report on the Company's website www.sunpharma.com. and on CDSL website at www.evotingindia.com.

12) In case of any grievance connected with voting by Postal Ballot, the Members may contact Mr. Ashok Bhuta, Compliance Officer at Sun Pharmaceutical Industries Limited, Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon East, Mumbai, Maharashtra (India) - 400 063 or at telephone 022 - 4324 4324 or by sending an e-mail at secretarial@sunpharma.com and in case of any grievance connected with electronic voting, the Members may contact Mr. Rakesh Dalvi, Deputy Manager, CDSL at designated email ids: helpdesk.evoting@cdslindia.com or at telephone no. 18002005533. Further in case of any query or issue regarding E-voting, the shareholders may refer the Frequently Asked Questions (FAQ) and E-voting User Manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com.

13) As directed by NCLT, M/s. C. J. Goswami and Associates, Practicing Company Secretary, Mumbai, has been appointed as the Scrutinizer to scrutinize the voting of equity shareholders by postal ballot, remote e-voting process and poll at the Meeting. Members are also requested to note a correction in the Notice of NCLT Convened Meeting of Equity Shareholders dated April 26, 2017 mailed/dispatched to the shareholders. The day of commencement of the voting period for remote e-voting and postal ballot shall be read as "Sunday, May 21, 2017 at 9:00 a.m. IST" instead of "Monday, May 21, 2017 at 9:00 a.m. IST" at all the places appearing in the said Notice.

For Sun Pharmaceutical Industries Limited  
 Dilip S. Shanghvi  
 Chairman appointed for the Meeting  
 Place: Mumbai  
 Date: 17.05.2017

**MAX VENTURES & INDUSTRIES**

MAX VENTURES AND INDUSTRIES LTD  
 (formerly Capricorn Ventures Limited)  
 (CIN: L85100PB2015PLC039204)  
 Regd. Office:  
 419, Bhal Mohan Singh Nagar  
 Village Ralimajra, Tehsil Balaschaur,  
 District Nawanshahr, Punjab - 144 533  
 Tel. No.: +91 1881 462000  
 Fax No.: +91 1881 273607  
 Website: www.maxvill.com  
 Email: secretarial@maxvill.com

**NOTICE**

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, May 25, 2017, inter alia, to take on record the audited financial results of the Company, for the financial year ended March 31, 2017.

This information is also available on the website of the Company at www.maxvill.com and on the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com.

For Max Ventures and Industries Limited  
 Noida, Uttar Pradesh  
 May 15, 2017  
**Alok Goel**  
 Company Secretary

**JSW Steel Limited**  
 Corporate Identification No. (CIN) - L27102MH1994PLC152925  
 Registered Office: JSW Centre, Bandra Kuria Complex, Bandra (East), Mumbai 400 051  
 Tel: 91 22 42861000 Fax: 91 22 42863000 E-mail: jsws.investor@jsw.in www.jsw.in

**Extract of Standalone Audited Financial Results for the quarter and year ended 31st March 2017**  
 (₹ in Crores)

Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
	31.03.2017	31.03.2017	31.03.2016
<b>Total revenue from operations</b>	16,951.67	56,913.25	10,614.87
<b>Net Profit / (Loss) for the period (before Tax, Exceptional)</b>	1,337.87	5,131.28	407.50
<b>Net Profit / (Loss) for the period before tax(after Exceptional)</b>	1,337.87	5,131.28	405.62
<b>Net Profit / (Loss) for the period after tax(after Exceptional)</b>	1,003.40	3,576.54	367.09
<b>Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period(after tax) and Other Comprehensive Income (after tax)]</b>	1,246.79	3,893.75	313.49
<b>Equity Share Capital</b>	240.30	240.30	239.87
<b>Other Equity (excluding Revaluation Reserve) as on 31st March 2017</b>		23,796.77	
<b>Earnings Per Share (of Re.1 each)(not annualised)</b>			
Basic (₹)	4.18	14.89	1.53
Diluted (₹)	4.15	14.80	1.52

**Extract of Consolidated Audited Financial Results for the Quarter and Year ended 31 March 2017**  
 (₹ in Crores)

Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
	31.03.2017	31.03.2017	31.03.2016
<b>Total revenue from operations</b>	17,917.22	60,536.25	11,747.16
<b>Net Profit / (Loss) for the period (before Tax, Exceptional)</b>	1,395.26	5,128.36	308.51
<b>Net Profit / (Loss) for the period before tax(after Exceptional)</b>	1,395.26	5,128.36	307.37
<b>Net Profit for the period/year (after Exceptional)</b>	1,008.58	3,467.24	300.69
<b>Total Comprehensive Income for the period / year [Comprising Profit / (Loss) for the period / year (after tax) and Other Comprehensive Income (after tax)]</b>	1,417.87	3,837.15	248.06
<b>Equity Share Capital</b>	240.30	240.30	239.87
<b>Other Equity (excluding Revaluation Reserve) as on 31st March 2017</b>		22,346.30	
<b>Earnings Per Share (of Re. 1 each) (not annualised)</b>			
Basic (₹)	4.22	14.66	1.24
Diluted (₹)	4.20	14.58	1.23

**Note** : The above is an extract of detailed format of quarterly /Annual Financial Result filed with Stock Exchanges under regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) regulations, 2015 The Full format of Quarterly / Annual Financial Results are available on the Stock Exchange Websites (www.bseindia.com & www.nseindia.com) and Company's Website (www.jsw.in)

Date : 17<sup>th</sup> May, 2017  
 Place : Mumbai  
 For JSW Steel Limited  
**Seshagiri Rao M.V.S**  
 Jt. Managing Director & Group CFO  
 Part of the O. P. Jindal Group  
**JINDAL**

**KALYANI INVESTMENT COMPANY LIMITED**  
 CIN : L65993PN2009PLC134196  
 Regd. Office : Mundhwa, Pune 411 036  
 Tel.: +91 20 66215000 Fax : +91 20 26821124  
 Email : investor@kalyani-investment.com  
 Website : www.kalyani-investment.com

**NOTICE**  
 Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the Meeting of the Board of Directors of the Company will be held on Thursday, May 25, 2017, inter-alia, to consider and approve Audited Financial Results for the quarter and year ended March 31, 2017.  
 The above information is available on the Company's website viz. www.kalyani-investment.com and also available on the websites of Stock Exchanges viz. www.bseindia.com and www.nseindia.com.

for Kalyani Investment Company Limited  
 Pune  
 May 17, 2017  
 Adwait Joshi  
 Company Secretary

**Morn Media Limited**  
 (Earlier known as Jagran Limited)  
 Regd. Office: Jagran Building, 2, Sarvodaya Nagar, Kanpur-208 005  
 CIN: L22121UP1983PLC006177 • ISIN : INE 343T01016  
 Ph. No. - 0512-2216161 • E-mail: mornmedialimited@hotmail.com

**NOTICE**  
 Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017  
 The information contained in this notice is also available on the Company's corporate website www.mornmedia.com and on the website of the stock exchange http://www.mse.in.

For Morn Media Limited  
 Sd/-  
**(Neetika Mathur)**  
 Company Secretary  
 Place : Kanpur  
 Date : 17/05/2017

**BALARAM CEMENTS LIMITED**  
 CIN: L26941GJ1985PLC007644  
 Registered Office: Village-Dhanpura, Post, Sarotra, Dist. Banaskantha, Pin 385135 Gujarat, India | Tel.: 09725661506 | Email: balaramcementsltd@hotmail.com

**FOR THE ATTENTION OF THE PUBLIC SHAREHOLDERS OF BALARAM CEMENTS LIMITED**

This Public Announcement ("PA") is being issued by Sukhdev Gadhvi, a Promoter of **Balaram Cements Limited ("BCL")**. BCL was listed on the Ahmedabad Stock Exchange which has now been non-operational/de-recognised by the Securities and Exchange Board of India (SEBI). Consequently BCL has been moved to the Dissemination Board of the National Stock Exchange of India Limited (NSE). BCL is currently engaged in the business of manufacturing of Cement.

The SEBI vide its Circular No. SEBI/HO/MRD/DSA/CIR/P/2016/110 dated 10th October, 2016 (SEBI Circular), has stipulated the procedure and process for exit of Exclusively Listed Companies (ELC) from the Dissemination Board. As provided in clause (i) of Annexure A of SEBI Circular, BCL has appointed Hem Securities Limited, a Category I Merchant Banker as Independent Valuer from NSE's panel of expert valuers. The said Independent Valuer, after taking into consideration the applicable valuation methodologies, has issued BCL its Valuation Report dated 8th May, 2017, and has determined the Fair Value of Equity Shares of BCL at ₹ NIL per share. Such Fair Value of the Equity Shares has been derived based on Net Asset value Method of Valuation. The Net Asset Value of BCL as per Audited Financial Statement as on March 31, 2016 is derived to be negative at ₹ (26,65,31,576)/-.

The said Valuation Report will be available for inspection at the Registered Office of BCL during office hours for a period of 10 days from the date of this Public Announcement.

**Other Details:**

i) **Shareholding:** As on date of letter of intent given to NSE (i.e. 25th April, 2017), the paid up Equity Share Capital of BCL was Rs 53,99,50,000 represented by 55,40,500 equity shares of ₹ 10 each as reduced by calls in arrears of Rs 5,500. Out of the total, 35,61,505 (64.29%) equity shares issued by BCL are held by the promoters and the balance 19,78,445 (35.71%) equity shares issued by BCL are held by public shareholders.

ii) **Financial Summary:**

Particulars	31.03.2016 (Audited in ₹)	31.03.2015 (Audited in ₹)	31.03.2014 (Audited in ₹)
Paid up Equity Share capital	5,53,99,500	5,53,99,500	5,53,99,500
Reserves and Surplus	(32,19,31,077)	(32,34,00,514)	(32,60,27,663)
Net Worth	(26,65,31,577)	(26,80,01,014)	(27,06,28,163)
Net Profit/(Loss) After Tax	14,69,437	26,88,613	19,92,042

Para (ii) of Annexure A to the said SEBI Circular states that in case the fair value of Equity Shares determined by the Independent Valuer is positive, the promoter of the Company shall acquire the shares from the public shareholders by paying them such value as determined by the Independent Valuer.

Presently in the Case, the fair Value determined by the Independent Valuer being NIL, the company will not acquire any shares from the public shareholders with no liability to make any payment to the said public shareholders.

In view of above, BCL will be making an application to NSE, requesting them to remove the name of BCL from the respective Dissemination Board of NSE. BCL undertakes to redress all the grievances of the public shareholders, if any.

For **BALARAM CEMENTS LIMITED**  
 Sd/-  
**Sukhdev Gadhvi**  
 Promoter & Director  
 (DIN:0000775)  
 Place: Ahmedabad  
 Date: 17/05/2017

**E Cap Equities Limited**

Corporate Identity Number - U67190TG2008PLC057122  
 Regd. Off: 2nd Floor, Mb Towers, Plot No 5, Road No 2, Banjara Hills, Hyderabad, Telangana 500034  
 Corporate Off: Edelweiss House, Off. C.S.T. Road, Kalina, Mumbai 400 098

**Financial Results for the six months and year ended March 31, 2017**  
 (₹ in Crores)

Particulars	Half Year Ended		Year Ended	
	March 31, 2017 Unaudited	March 31, 2016 Unaudited	March 31, 2017 Audited	March 31, 2016 Audited
1 Income from operations	113.25	558.78	215.55	625.13
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.38	57.54	1.37	46.06
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.38	57.54	1.37	46.06
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	23.38	61.38	1.85	49.90
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	23.38	61.38	1.85	49.90
6 Paid up Equity Share Capital (Face Value of Rs 10/- Per Share)	0.24	0.24	0.24	0.24
7 Reserves (excluding Revaluation Reserve)	248.00	246.15	248.00	246.15
8 Net worth *	248.09	245.15	248.09	245.15
9 Paid up Debt Capital / Outstanding Debt	1,669.58	872.26	1,669.58	872.26
10 Outstanding Redeemable Preference Shares	3.60	3.60	3.60	3.60
11 Debt Equity Ratio **	6.73	3.56	6.73	3.56
12 Earnings Per Share (EPS) in Rupees (Face value of Rs. 10 per share)				
- Basic (Not annualised)	974.36	2,544.74	77.03	2,066.48
- Diluted (Not annualised)	974.36	2,544.74	77.03	2,066.48
13 Capital Redemption Reserve	-	-	-	-
14 Debenture Redemption Reserve	0.44	-	0.44	-
15 Debt Service Coverage Ratio ***	0.12	1.71	0.20	1.32
16 Interest Service Coverage Ratio ****	1.28	1.71	1.01	1.32

\*Net worth = Share capital + Share application money pending allotment + Reserves & Surplus - Deferred Tax Assets  
 \*\*Debt-equity Ratio = Total debt (Long term + Short term + Current maturities of long term debt) / Net worth  
 \*\*\*DSCR = Profit before interest and tax / Interest expense + Principal repayment in next six months  
 \*\*\*\*ISCR = Profit before interest and tax / Interest expense

Notes:-

- The above is an extract of the detailed format of annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the annual financial results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the Company's website - www.edelweissfin.com.
- The financial results of ECap Equities Limited ("Ecap" or 'the Company') for the six months and year ended March 31, 2017 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 16, 2017.
- For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange(s) (BSE Limited) and can be accessed on the the Company's website - www.edelweissfin.com.
- Earnings per share for the half year ended March 31, 2017 and March 31, 2016 have been calculated for six months and not annualised.

On the behalf of Board of Directors  
 T.K. Ramaswamy  
 Director  
 Din: 05158707  
 Mumbai, May 16, 2017



**FIEM INDUSTRIES LIMITED**  
Regd. Office: D-34, DSIDC Packaging Complex, Kirti Nagar  
New Delhi-110015 (INDIA) Tel: +91-11-25927919/7820  
Fax: +91-11-25927740 E-mail: investor@fiemindustries.com  
Website: www.fiemindustries.com CIN: 136599011989PLC034293

**NOTICE**  
Pursuant to Regulation 47 read with 29 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, May 30, 2017 at 2.30 p.m. at the Corporate Office of the Company situated at Plot No. 1915, Rai Industrial Estate, Phase-V, Distt. Sonapat, Haryana, inter-alia, to consider and approve stand alone and consolidated Audited Financial Results of the Company for the Quarter and Financial Year ended March 31, 2017 and to consider and recommend Final Dividend, if any, for financial year 2016-17.  
The said Notice will also be available at the Company's website www.fiemindustries.com and websites of stock exchanges www.bseindia.com and www.nseindia.com. In above connection, it is also informed that in terms of Company's Code of Conduct to Regulate, Monitor and Report Trading by Insiders (Code), the 'Trading Window' for dealing in securities of the Company will remain closed from May 23, 2017 to June 01, 2017 (both days inclusive) for the Directors, Insiders and Designated Persons as per Code.  
For Fiem Industries Ltd. Sd/- Arvind K. Chauhan  
Place : Rai, Haryana Company Secretary

**MAX VENTURES & INDUSTRIES LTD**  
(formerly Capricorn Ventures Limited)  
(CIN: L85100PB2015PLC032044)  
Regd. Office:  
419, Bhai Mohan Singh Nagar,  
Village Rallimara, Tehsil Balachaur,  
District Nawanshahr, Punjab - 144 533  
Tel. No.: +91 1881 462000  
Fax No.: +91 1881 273007  
Website: www.maxvill.com  
Email: secretarial@maxvill.com

**NOTICE**  
Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, May 25, 2017, inter alia, to take on record the audited financial results of the Company, for the financial year ended March 31, 2017.  
This information is also available on the website of the Company at www.maxvill.com and on the Stock Exchanges where the shares of the Company are listed at www.bseindia.com and www.nseindia.com.  
For Max Ventures and Industries Limited  
Noida, Uttar Pradesh Sd/- Alok Goel  
May 15, 2017 Company Secretary

**SBI**  
IT-TSS, GITC, Omsagar Building,  
Nerul, MIDC, Navi Mumbai  
**CORRIGENDUM No.2**

Bank has decided to extend the date of submission of bids and other terms & conditions of RFP no SBI/GITC/IT-TSS/2017-18/379 dated 27.04.2017 under corrigendum no 2 dated 17.05.2017 published on Bank's official website. The details are available on Bank's official website [www.sbi.co.in](http://www.sbi.co.in) under procurement news.  
**DGM (IT-TSS)**

**Sri Chamundeswari Sugars Ltd.**  
CIN: L15435KA1970PLC001974  
Regd. Office: No. 88/5, Richmond Road,  
Bangalore-560025  
Email: ho@chamundeswarisugars.com  
Ph: 080-25002500 Fax: 25002510

**NOTICE**  
Sri Chamundeswari Sugars Ltd. is hereby given, pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015 that a meeting of Board of Directors of the Company will be held on Tuesday, 30th May 2017, inter alia to consider and take on record the Audited Financials Results of the Company for the year ended 31st March, 2017.  
for Sri Chamundeswari Sugars Ltd.  
Sd/- J U Sivanasan  
Chief Financial Officer  
Place: Bangalore Date: 17<sup>th</sup> May 2017

**Morn Media Limited**  
(Earlier known as Jagran Limited)  
Regd. Office: Jagran Building, 2, Sarodaya Nagar, Kanpur-208 005  
CIN: L22121UP1983PLC006177 / ISIN: INE 343701016  
Ph. No. - 0512-2216161 / E-mail: mornmedia@hotmail.com

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017. The information contained in this notice is also available on the Company's corporate website [www.mornmedia.com](http://www.mornmedia.com) and on the website of the stock exchange <http://www.mscl.in>.  
For Morn Media Limited Sd/-  
Neetika Mathur  
Company Secretary

Place : Kanpur  
Date : 17/05/2017

**BEEKAY NIRYAT LIMITED**  
CIN: L67120RJ1875PLC045573  
Regd. Office: SP - 825, Road No. 14, Vishwakarma Industrial Area, Jaipur-302013  
Corp Office: 93, Hargobind Street, Kolkata - 700017  
Tel: 033-22618344 Fax: 033-30235391  
Email: beekayniryat1975@gmail.com  
Web: www.beekayniryat.co.in

**NOTICE**  
Notice is hereby given pursuant to Regulations 29(1)(a) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of Board of Directors of the Company will be held at the corporate office of the Company on Tuesday, 30th day of May, 2017 at 04.00 PM. to consider, approve and take on record, inter-alia, the Un-Audited Financial Results for the quarter ended 31st March 2017 among other items.  
By Order of the Board For Beekay Niryat Limited Sd/-  
Sree Gopal Bajoria  
CIN: 01102207  
Managing Director

Place : Jaipur  
Date : 15th May 2017

**Chartered Capital And Investment Limited**  
Reg. Office: 11, Mahatma Jyoti Bapu Road, New Market, Guwahati-781005  
Ph: 079-2657537 Fax: 079-26575731 CIN: L45101GU1989PLC005877  
Email: info@chartercapital.net Website: www.chartercapital.net

**NOTICE**  
Pursuant to regulation 29 and regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of Board of Directors of the company will be held on Tuesday, May 30, 2017 at the registered office of the Company, inter-alia, to consider and approve Audited Financial Results of the company for the quarter and year ended March, 31, 2017. This information is also available on the company's website at [www.chartercapital.net](http://www.chartercapital.net) and on the website of the stock exchange at [www.bseindia.com](http://www.bseindia.com).  
For Chartered Capital And Investment Limited Sd/-  
Mohib N Khercha  
Managing Director

Place: Ahmedabad  
Date: May 17, 2017

**Indian Institute of Technology Guwahati**  
Guwahati-781039, Assam

Quotations are invited for supply & installation of  
1. CONTROLLED ENVIRONMENT CHAMBER.  
2. INFRARED THERMAL IMAGING CAMERA.  
3. DIFFUSION WAVE SPECTROPHOTOMETER.  
For details please visit  
[www.iitg.ac.in/home/tender/19](http://www.iitg.ac.in/home/tender/19)  
NANO/PIAC/11  
xMESPNSER801124x06M002  
xCLSPNSER800771xDPB06AR(R&D)

**Bank of India**  
Relationship beyond banking  
Head Office, Card Products Department, C-4, 'G' Block, Star House - II, 1st Floor, Bandra - Kurla Complex, Bandra (E), Mumbai - 400 051. E-mail: headoffice.CPD@bankofindia.co.in

**REQUEST FOR PROPOSAL (RFP)**  
**FOR OUTSOURCING OF "End to End" CREDIT CARD MANAGEMENT**  
The captioned RFP is available on Bank's corporate website till **06.06.2017**. Details available on the Bank's Corporate Website [www.bankofindia.co.in](http://www.bankofindia.co.in) under "Tender" section. Any subsequent corrigendum will be put on the website only.  
-GENERAL MANAGER

**STAR PAPER MILLS LIMITED**  
Registered Office: Dunesan House, 2nd Floor,  
31, Netaji Subhas Road, Kolkata 700 001  
Ph: 033-22427380 Fax: 033-22427383  
CIN: L20141WB1936PLC008726  
E-mail: star.cal@starpapers.com Web: www.starpapers.com

**Notice**  
Notice is hereby given pursuant to the provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the company is scheduled to be held on Thursday, 25th May, 2017 at New Delhi to inter-alia consider and approve the Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2017 and consider recommendation of dividend for FY 2016-17.  
The Notice is also available on website of the company ([www.starpapers.com](http://www.starpapers.com)) and that of BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)) and National Stock Exchange of India Limited ([www.nseindia.com](http://www.nseindia.com)).  
Further, as per Insider trading code of the company, 'Trading Window' shall remain closed from 18th May, 2017 to 27th May, 2017 (both days inclusive).  
for STAR PAPER MILLS LTD. Sd/-  
SAURABH ARORA  
(Company Secretary)  
Saharanpur (U.P.)  
16th May, 2017.

**ADLABS Entertainment Limited**  
Registered Office: 30/31, Sangewadi, Khopoli-Pali Road, Taluka Khalapur,  
District Raigad 410 203, Maharashtra, India.  
Corporate Office: 9<sup>th</sup> Floor, Lotus Business Park, New Link Road, Andheri (West),  
Mumbai 400 053, Maharashtra, India.  
CIN: L92490MH2010PLC199925, Tel: +91 22 4068 0000; Fax: +91 22 4068 0088  
Email: compliance@adlabsentertainment.com Website: [www.adlabsimga.com](http://www.adlabsimga.com)

**NOTICE**  
Pursuant to Regulation 47 read with Regulations 29 and 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Thursday, May 25, 2017, inter alia, to consider and approve Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and year ended March 31, 2017.  
The said notice is also available on the Company's website at [www.adlabsimga.com](http://www.adlabsimga.com) and may also be accessed on the Stock Exchange websites at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).  
For Adlabs Entertainment Limited Sd/-  
Madhulika Rawat  
Company Secretary  
Place : Mumbai  
Date : May 17, 2017

**Chhatrapati Shivaji International Airport Mumbai**  
**GVK**  
**Mumbai International Airport Pvt. Ltd.**  
**Request for Qualification-cum-Request for Proposal for International Cargo Concession**  
Mumbai International Airport Pvt. Ltd. (MIAL) intends to grant the concession of existing International Air Cargo facilities of MIAL at Chhatrapati Shivaji International Airport (CSIA), on as-is-where-is basis, to a party selected through a competitive bidding process.  
MIAL hereby invites interested parties to participate in the competitive bidding process by submitting an application to MIAL which can be downloaded from the CSIA website (<http://csia.in/business-opportunities/commercial-opportunities.aspx>).  
A detailed Request for Qualification-cum-Request for Proposal (RFQP) containing eligibility criteria, terms of the bidding process and scope of concession shall be provided to the applicants who submit application, along with the cost to MIAL.  
Last date for submission of Bids pursuant to this competitive bidding process is **5.30 pm IST on June 27, 2017**.

**ASHIANA HOUSING LIMITED**  
CIN: L70109WB1966PLC04084  
Regd. Office: 5F, Everest, 46/C, Chowringhee Road, Kolkata-700 071  
Head Office: Unit No. 4&5, 3rd Floor,  
Plot No. D-2, Saket District Center, Saket,  
New Delhi-110017  
Phone: 011-42654265, Fax: 011-4265 4200  
Email: investorrelations@ashianahousing.com  
website: [www.ashianahousing.com](http://www.ashianahousing.com)

**NOTICE**  
This is to inform that next meeting of the Board of Directors of the company will be held on Tuesday, 30th May, 2017 at 10.30 AM at the Head office of the company at Unit No. 4 & 5, 3rd Floor, Saket District Center, Saket, New Delhi - 110 017, to consider and approve annual audited financial results of the company for the financial year ended on 31st March, 2017 including audited quarterly financials in respect of the last quarter ended on 31st March, 2017, apart from other routine items.  
By Order of the Board Ashiana Housing Ltd. Sd/-  
Nitin Sharma  
(Company Secretary)  
ACS: 21191  
Place : New Delhi  
Date : 17/05/2017

**SUGAR AND IND COR**  
**K.C.P. SUGAR AND INDUSTRIES CORPORATION LIMITED**  
Regd. Office: "Ramakrishna Buildings"  
No. 239, Anna Salai, Chennai - 600 006  
CIN: L15421TN1995PLC033198

**NOTICE**  
NOTICE is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015, a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, the 29th day of May, 2017 at the Registered Office of the Company, to consider, approve and take on record the Audited Financial Results of the Company and recommendation of dividend, if any, for the year ended 31st March 2017.  
Further, as per the provisions of SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 (as amended) read with the Code for Prevention of Insider Trading in Securities of K.C.P. Sugar and Industries Corporation Limited, the trading window for trading in the equity shares of the Company by any "Insider" covered under the said Code will be closed from Thursday, May 18, 2017 to Wednesday, May 31, 2017 (both days inclusive).  
This information is available on the website of the Company [www.kcpsugar.com](http://www.kcpsugar.com) and also on the websites of Stock Exchanges, viz. [www.nseindia.com](http://www.nseindia.com) (National Stock Exchange of India Limited) and [www.bseindia.com](http://www.bseindia.com) (BSE Limited) where the Equity Shares of the Company are listed.  
for K.C.P. SUGAR AND INDUSTRIES CORPORATION LIMITED  
S.Chidambaram  
18.05.2017 General Manager (Finance)  
Chennai - 600006 & Company Secretary

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017. The information contained in this notice is also available on the Company's corporate website [www.mornmedia.com](http://www.mornmedia.com) and on the website of the stock exchange <http://www.mscl.in>.  
For Morn Media Limited Sd/-  
Neetika Mathur  
Company Secretary

**सन फार्मास्यूटिकल इंडस्ट्रीज लिमिटेड**  
SUN PHARMA  
Regd. Office: 5F, Everest, 46/C, Chowringhee Road, Kolkata-700 071  
Head Office: Unit No. 4 & 5, 3rd Floor, Plot No. D-2, Saket District Center, Saket, New Delhi-110017  
Phone: 011-42654265, Fax: 011-4265 4200  
Email: investorrelations@ashianahousing.com  
website: [www.ashianahousing.com](http://www.ashianahousing.com)

**NOTICE**  
This is to inform that next meeting of the Board of Directors of the company will be held on Tuesday, 30th May, 2017 at 10.30 AM at the Head office of the company at Unit No. 4 & 5, 3rd Floor, Saket District Center, Saket, New Delhi - 110 017, to consider and approve annual audited financial results of the company for the financial year ended on 31st March, 2017 including audited quarterly financials in respect of the last quarter ended on 31st March, 2017, apart from other routine items.  
By Order of the Board Ashiana Housing Ltd. Sd/-  
Nitin Sharma  
(Company Secretary)  
ACS: 21191  
Place : New Delhi  
Date : 17/05/2017

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017. The information contained in this notice is also available on the Company's corporate website [www.mornmedia.com](http://www.mornmedia.com) and on the website of the stock exchange <http://www.mscl.in>.  
For Morn Media Limited Sd/-  
Neetika Mathur  
Company Secretary

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017. The information contained in this notice is also available on the Company's corporate website [www.mornmedia.com](http://www.mornmedia.com) and on the website of the stock exchange <http://www.mscl.in>.  
For Morn Media Limited Sd/-  
Neetika Mathur  
Company Secretary

**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that the Meeting of the Board of Directors of Morn Media Limited is scheduled to be held on Saturday, the 27<sup>th</sup> February, 2017 inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the year ended 31<sup>st</sup> March, 2017. The information contained in this notice is also available on the Company's corporate website [www.mornmedia.com](http://www.mornmedia.com) and on the website of the stock exchange <http://www.mscl.in>.  
For Morn Media Limited Sd/-  
Neetika Mathur  
Company Secretary

**OFFER OPENING PUBLIC ANNOUNCEMENT For the Attention of Equity Shareholder of DEEPTI ALLOY STEEL LIMITED**  
Registered Office : 308, Shital Varsha Arcade, Opp. Girish Coldrinks, C.G Road, Navrangpura, Ahmedabad-380009.  
CIN:L40100GJ1993PLC018943, Tel No. 079-26440427  
Website : [www.deeptialloysteel.com](http://www.deeptialloysteel.com), E Mail: investor.deepti@gmail.com

This Advertisement ("Pre-offer Advertisement") is being issued by Gretex Corporate Services Private Limited (Manager to the Offer), for and on behalf of Mr. Parikshit Mahatma, Mrs. Sangita Jain (Acquirers) and Mr. Rajeev Mahatma, Mrs. Reena Mahatma, Mrs. Sonal Mahatma and Ms. Neha Jain (PACs) pursuant to Regulation 18(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulation, 2011 in respect of the open offer to Acquire 10,01,104 Equity shares of Rs. 10 each representing 26% of Issued, Subscribed and Paid up Capital of Deepti Alloy Steel Limited (Target company).  
This Pre-Offer Advertisement is to be read in conjunction with the Public Announcement dated September 22, 2016; The Detailed Public Statement ("DPS") which was published on September 29, 2016 and Corrigendum to DPS was published on March 01, 2017 in Financial Express (English) (English, All Editions), Jansatta (Hindi) (Hindi, All Editions), The Financial Express (Gujarati) and Laksheed (Marathi, Mumbai Edition).  
The capitalised terms used in this Pre-Offer Advertisement have the meaning assigned to them in the LoF, unless otherwise specified.

- The Offer Price is Rs. 10 (Rupees Ten Only) per Equity share payable in cash in accordance with Regulation 9(1) of SEBI (SAST) Regulations. There has been no revision in the Offer Price.
- The Committee of Independent Directors (ICD) of the Target Company have opined that the Offer price of Rs 10 (Rupees Ten Only) is fair and reasonable in accordance with SEBI (SAST) Regulation. The ICD's recommendation was published on May 17, 2017 in the same newspapers in which the DPS was published, as mentioned above.
- This Open Offer is not a competing offer in terms of Regulation 20 of the SEBI (SAST) Regulations. No competitive Offer has been made.
- The LoF dated May 09, 2017 was dispatched to the Public Shareholders holding Equity Shares in dematerialised form and/or in physical form as on the Identified Date (i.e. May 05, 2017).
- Please note that a copy of Letter of Offer (including Form of Acceptance cum acknowledgement) is also available on website of SEBI at <http://www.sebi.gov.in/>. Registered/unregistered shareholders if they may also apply on the form of acceptance download from the SEBI website. Further in case of non receipt/non availability of the Form of Acceptance cum acknowledgement, the application can be made on plain paper along with the following details and to be sent to Registrar to the offer:  
In the case of the Equity Shares held in physical form:  
An Eligible person may participate in the offer by completing these consent to participate in this offer on terms and conditions of this offer as set out in the PA, the DPS and in the letter of offer. They can participate by submitting an application to the selling member on plain paper giving details regarding their shareholding and relevant documents mentioned in the letter of offer. The selling member(s)/investor have to deliver the physical share certificate & other relevant documents along with TRS ("Transaction Register Slip") to the Registrar and Transfer agent (RTA) by registered post, speed post or courier or hand delivery. Physical share certificate and other relevant document will have to reach RTA within 2 days from the closing of the open offer. The envelop should be subscribed as Deepti Alloy Steel Limited-open offer.  
In the case of the Equity Shares held in dematerialized form: An Eligible Shareholder including non-resident shareholder may participate in the Open Offer by approaching their broker by providing his/her/its application in writing on a plain paper, signed by all Eligible Shareholders (in case of joint holding), stating name and address of the Eligible Shareholder(s), number of Equity Shares held, Client ID number, DP Name, DP ID, beneficiary account number, number of Equity Shares tendered in the Offer, delivery instruction slip duly executed and enclosing documents such as statutory approval(s), if any.  
The requisite documents along with Transaction Registration Slip (TRS) are required to be sent by the shareholders/selling brokers to the Registrar to the Offer mentioned below:

Address of the Registrar to the offer	Contact Person and Details	Mode of Delivery
Satellite Corporate Services Private Limited B-302, Sony Apartment, Opp. St. Jude High School, 90 ft. Road, Off Andheri Kurda Road, Jarimar, Sakinaka, Mumbai - 400 072.	Mr. Michael Monteiro Tel: +91-22-28520461/462 Fax: +91-22-28511809 Email: d.service@satellitecorp.com Website: <a href="http://www.satellitecorp.com">www.satellitecorp.com</a>	Hand Delivery/ Registered Post/ Speed Post

- The open offer will be implemented by the acquirer through a stock exchange mechanism made available by BSE Limited in the form of a separate window ("Acquisition Window") as provided under the SEBI (SAST) Regulations and SEBI circular CIR/CFD/POLICY/CELL/1/2015 dated April 13, 2015 read with SEBI circular CFD/DCR2/CIR/PT/2016/131 dated December 9, 2016. For further details, the Public Shareholders are requested to refer to Part VIII titled "Procedure for Acceptance and Settlement of the Offer" on page 24 of the LoF.
- All Observations received from SEBI dated May 02, 2017 bearing reference No SEBI/HO/CFD/DCR/1/OWP/17/9880/1 in terms of Regulation 16(4) of the SEBI (SAST) Regulation have been incorporated in the Letter of Offer.
- Material updates since the date of the Public Announcement:  
There have been no other material updates in relation to the Open Offer since the date of the Public Announcement, save as otherwise disclosed in the DPS (as amended by the Corrigendum,) and the LoF.
- Equity shares once tendered through the Form of Acceptance or through other valid modes in the Offer cannot be withdrawn by the shareholders in terms of Regulation 18(9) of the SEBI (SAST) Regulations, 2011.
- To the best of Knowledge of the Acquirers, no statutory approvals are required by them to complete this offer. However in case of any statutory approvals being required at a later date, this offer will be subject to such approvals.
- Revised Schedule of Activity is as follow:

Activity	Current		Revised	
	Day	Date	Day	Date
Public Announcement (PA)	Thursday	September 22, 2016	Thursday	September 22, 2016
Detailed Public Statement (DPS)	Thursday	September 29, 2016	Thursday	September 29, 2016
Corrigendum to the DPS	Wednesday	March 1, 2017	Wednesday	March 1, 2017
Last date for a competing Offer	Monday	October 24, 2016	Monday	October 24, 2016
Identified Date*	Monday	April 03, 2017	Friday	May 05, 2017
Letter of Offer to be dispatched to shareholders	Tuesday	April 11, 2017	Friday	May 12, 2017
Last date for revising the Offer price/number of shares	Thursday	April 13, 2017	Tuesday	May 16, 2017
Last Date by which Board of TC shall give its recommendation	Monday	April 17, 2017	Wednesday	May 17, 2017
Date of publication of Offer Opening Public Announcement	Tuesday	April 18, 2017	Thursday	May 18, 2017
Period of commencement of Tendering (Offer Opening Date)	Friday	April 19, 2017	Friday	May 19, 2017
Date of closure of Tendering Period (Offer Closing Date)	Wednesday	May 03, 2017	Thursday	June 01, 2017
Date by which all the requirements including payment of consideration would be Completed	Thursday	May 18, 2017	Thursday	June 15, 2017

\*The Identified Date is only for the purpose of determining the Equity shareholders as on such date to whom the Letter of Offer would be sent. It is clarified that all the Equity Shareholders of Target Company (registered or unregistered), except the Acquirers, PACs and the Promoter of the Target Company (parties to the Share Purchase Agreement) are eligible to participate in this Offer at any time prior to the closure of this Offer.

The Acquirers and PACs accept full responsibility for the information contained in this announcement and also for the fulfillment of their obligations laid down in the SEBI SAST Regulations.  
A copy of this Offer Opening Public Announcement shall also be available on the SEBI website at [www.sebi.gov.in](http://www.sebi.gov.in).

**ISSUED BY THE MANAGER TO THE OFFER:**  
**Manager to the offer: GRETEX CORPORATE SERVICES PRIVATE LIMITED**  
SEBI Registration No: INM000012177  
Contact Person: Mr. Tanmay Banerjee  
Office No.-13, 1st Floor, (New Bansal Building), 9-15, Horni Modi Street, Fort., Mumbai - 400023  
Tel: +91 22 40025273 / 9836822199 / 9836821999,  
Fax: +91 22 40025273  
Email: info@gretexgroup.com, Website: [www.gretexcorp.com](http://www.gretexcorp.com)

**FOR AND ON BEHALF OF:**

Acquirer(s)	PAC (1)	PAC (2)	PAC (3)
Mr. PARIKSHIT MAHATMA R/o JalChakki, Nathdwara Road, Rajasmand, Kankrol-313 324, Rajasthan, (Acquirer No. 1)	MR. RAJEEV MAHATMA R/o JalChakki, Nathdwara Road, Rajasmand, Kankrol-313 324,	Mrs. REENA MAHATMA R/o JalChakki, Nathdwara Road, Rajasmand, Kankrol-313 324,	Mrs. SONAL MAHATMA R/o JalChakki, Nathdwara Road, Rajasmand, Kankrol-313 324,
Mrs. SANGITA JAIN R/o 9 Vraj Villa Banglows, B/h Iscon Mall, Bodakdev, Ahmedabad-380054, Gujarat. (Acquirer No. 2)	Ms. NEHA JAIN R/o 9 Vraj Villa Bunglow, B/h Iscon Mall, Bodakdev, Ahmedabad-380 054, Gujarat, (PAC No. 4)		

Place : Ahmedabad  
Date : May 17, 2017

**Tamilnadu Petroproducts Limited**  
Regd. Office: Manali Express Highway, Manali, Chennai 600 068  
website: [www.tnpetro.com](http://www.tnpetro.com) Email: secy-legal@tnpetro.com. Telefax: 044-25945588  
CIN: L23200TN1984PLC010931

**EXTRACT FROM THE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31<sup>st</sup> MARCH 2017**  
(Rs. in lakhs)

Sl.no	Particulars	QUARTER ENDED			YEAR ENDED			
		31.03.2017 Audited	31.12.2016 Unaudited	31.03.2016 Audited	Standalone		31.03.2016 Audited	
					31.03.2017 Audited	31.03.2016 Audited		31.03.2017 Audited
1)	Total Income from operations	28,164	23,874	14,716	1,00,758	79,245	1,00,758	79,245
2)	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(774)	920	(926)	1,696	(1956)	1,871	(2078)
3)	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	1,726	920	(926)	4,196	3,815	4,371	3,693
4)	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(1,515)	920	(926)	955	3,815	1,129	3,690
5)	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	NA	NA	NA	NA	NA	NA	NA
6)	Equity Share Capital	8,997	8,997	8,997	8,997	8,997	8,997	8,997
7)	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	17,885	16,930	20,381	19,252
8)	Earnings per Share (before extraordinary items) (of Rs. / - each)	(1.68)*	1.02*					



